

૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)

૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓની વિગત

નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ જિલ્લાની બહેનોએ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર મહિલાઓનું કરાયેલું સન્માન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અવસરે નવસારી ટાટા હોલ ખાતે નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લા સહિત સુરત રેન્જ પોલીસ વિભાગ ધ્વારા રાજ આઇજી શ્રી ડો. શમરેસિંહ, સુરત જિલ્લાસ પ્રિન્સીપલ જજ સુશ્રી ગીતાબેન ગોપી, સુરત ગ્રામ્ય અને નવસારી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ રાય, શ્રી સુનિલ જોષી, પોલીસ અધિક્ષક વલસાડ, શ્રી એન.કે. અમિન, પોલીસ અધિક્ષક, તાપીનાઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી.



સુરત રેન્જ

પોલીસ- નવસારી- સુરત રુરલ- તાપી-વલસાડ-ડાંગ જિલ્લા ધ્વારા આયોજીત ૦૮ માર્ચ -૨૦૧૭ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિત્તે મહિલા રેલી



સુરત રેન્જ પોલીસ ધ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નવસારી ટાટા હોલ ખાતે કરવામાં આવી





સુરત રેન્જ પોલીસ- નવસારી- સુરત ડુરલ- તાપી-વલસાડ-ડાંગ જિલ્લા ધ્વારા આયોજીત ૦૮ માર્ચ - ૨૦૧૭ આંતરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી નિમ્ને દિપ પ્રાગટ્ય



સુરત પોલીસ ધ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અવસરે ગણેશ વંદનાથી શરુઆત કરવામાં આવી



આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અવસરે સ્ટુડન્ટ પોલીસ કેડેટસ



### મુદા નંબર (૧)

1. જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સહકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ <http://trackthemissingchild.gov.in/missing/index.php> ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલારાપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાઇવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

### મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

### મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એકસીડન્ટ ઝોન નક્કી કરી રોડ એકસીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ કોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્વેસ્ટીગેશનમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજામાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

### મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરૂપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.